

બેન્કના હાલના પ્રવર્તમાન ચાર્જસ ટા.૦૧-૦૭-૨૦૨૧ થી અમલમાં આવે તે રીતે નીચે દર્શાવ્યા મુજબ લેવાનું ઠરાવ્યું.

અ.નં.	બેંકીંગ સર્વિસ	ટા.૦૧-૦૭-૨૦૨૧ થી અમલી ચાર્જસ રૂ. + એપ્લીકેબલ GST
૧.	(A). લોકર્સ ભાડુ એ. બી. સી. ડી. ઈ. એફ. જી. એચ. આઈ. કે. ૬૦૦.૦૦ ૮૦૦.૦૦ ૯૦૦.૦૦ ૧૦૫૦.૦૦ ૧૩૦૦.૦૦ ૨૦૦૦.૦૦ ૨૩૦૦.૦૦ ૨૩૦૦.૦૦ ૧૯૦૦.૦૦ ૩૩૦૦.૦૦	
	(B) કબાટ	૫૫૦૦.૦૦
૨.	A. કુરિયર ચાર્જસ B. પોસ્ટેજ ચાર્જસ - રજીસ્ટર્ડ C. પોસ્ટેજ ચાર્જસ - રજી.એ.ડી. Collection હેઠળ જે ચાર્જ કરીએ તે માટે	૫૦.૦૦ ૬૦.૦૦ ૭૦.૦૦ ડીવીડન્ડ વોરંટ કોઈપણ રકમનું હોય તે માટે કમિશન ચાર્જ થશે નહીં. ફક્ત ઉપર મુજબ કુરિયર કે પોસ્ટેજ ચાર્જ લાગશે.
૩.	ડ્રુપ્લીકેટ એકાઉન્ટ સ્ટેટમેન્ટ	A. ચાલુ વર્ષ માટે પાના દીઠ રૂ.૧૦/-, B.પાછલા નાણાંકીય વર્ષ માટે પાના દીઠ રૂ.૧૦/-
૪.	ડ્રુપ્લીકેટ પાસબુક	૧૦૦.૦૦
૫.	ડ્રુપ્લીકેટ ટર્મ ડીપોઝીટ	રીસીપ્ટ દીઠ રૂ.૬૦/-
૬.	ચેક રીટર્ન ચાર્જસ - OBC માટે -શાખામાં લોકલ કલીયરીંગ માં કલેકશન માટે ખાતેહારે નાંખેલ ચેકો રીટર્ન થાય તો તે રીટર્ન ચેક દીઠ રીટર્ન ચાર્જસ - ફાયનાન્સ કંપની / અન્ય બેન્કો ને વ્હીકલ/હાઉસીંગ ધીરાણ માટે માસિક હપ્તાના ચેકો આપણા ખાતેહારો દ્વારા જે આપવામાં આવેલ હોય તે ચેકો બેલેન્સનાં અભાવે પરત થતાં હોય તેવા પ્રત્યેક રીટર્ન ચેક માટે - ECS / ACH etc. રીટર્ન ચાર્જસ	૧૦૦.૦૦ ૧૦૦.૦૦ ૪૦૦.૦૦ ૩૫૦.૦૦
૭.	ફાયનાન્સ કંપની/લીઝીંગકંપની અગર અન્ય બેન્કોને લોનની ચૂકવણી પેટે પોસ્ટડેટેડ ચેકો આપવા માટે ગ્રાહકોને ચેક બુક જે આપવામાં આવે છે તેના પ્રત્યેક ચેક દીઠ	રૂ.૧૫.૦૦
૮.	Stock / Book Debt / મશીનરી / વ્હીકલ ઈન્સ્યુરેશન ચાર્જસ	સ્ટોક, બુકડેબ્ટ તથા મશીનરી ઈન્સ્યુરેશન દીઠ રૂ.૧૫૦/-

૯.	રીકર્ડિંગ ખાતામાં હપ્તા મોડા ભરાતા ગોંધ - ખાતેદાર દ્વારા રીકર્ડિંગના હપ્તા મોડા ભરાય તો મોડા ભરાયેલ હપ્તા ઉપર સેંકડે રૂ.૧.૦૦ પેનલ્ટી પ્રતિમાસ ધોરણે ચાર્જ કરવાની રહેશે.	સેંકડે રૂ.૧૦.૦૦
૧૦.	સ્ટોક/બુકડેબ્ટ સ્ટેટમેન્ટો મોડા આવે તો...	૧૨ તારીખ બાદ આવતા સ્ટેટમેન્ટો માટે લીમીટ ઉપર ૨.૦૦% પીનલ વ્યાજ GST લાગશે.
૧૧	૧ વર્ષ પહેલા બંધ થતા ખાતાના ચાર્જ્સ ... A. સેવિંગ્સ વીડ્રોલ B. ચેકબુક સીસ્ટમ વાળા ખાતામાં C. કરન્ટ ખાતા ૧ વર્ષ પહેલા બંધ થતા ...	૨૦૦.૦૦ ૩૦૦.૦૦ ૫૦૦.૦૦ Basic Savings accounts ને લાગુ પડશે નહીં.
૧૨.	સ્ટોપ પેમેન્ટ ચાર્જ્સ સીંગલ ચેક સ્ટોપ પેમેન્ટ	૧૦૦.૦૦
૧૩.	ખોવાયેલ ચેક બુક સ્ટોપ પેમેન્ટ	ખોવાયેલચેક દીઠ રૂ.૧૦૦/- વધુમાં વધુ રૂ.૭૦૦.૦૦
૧૪.	બેલેન્સ સર્ટીફિકેટ ચાર્જ્સ સેવિંગ્સ ખાતા કરન્ટ / લોન ખાતા	૧૦૦.૦૦ ૧૫૦.૦૦
૧૫.	ડુપ્લીકેટ ડી.ડી. ઇસ્યુ ચાર્જ્સ/કેન્સલેશન ચાર્જ્સ	૧૫૦.૦૦
૧૬.	સેવિંગ્સ ખાતામાં લેસ બેલેન્સ ચાર્જ્સ	NO CHARGE
૧૭.	ચેકબુક ઇસ્યુ ચાર્જ્સ સેવિંગ્સ ખાતા માટે (Personalised MICR ચેકબુક) કરન્ટ/ ઓવરડ્રાફ્ટ ખાતા માટે (Personalised MICR ચેકબુક)	ખાતુ ખોલતી વખતે MICR / Personalised ચેકબુક ૧૫ પાનાની ચેકબુક ફી. ત્યારબાદ પ્રત્યેક ચેક દીઠ રૂ.૧.૦૦ વસુલ. ખાતુ ખોલતી વખતે MICR / Personalised ચેકબુક ૩૦ પાનાની ચેકબુક ફી.ત્યારબાદ પ્રત્યેક ચેક દીઠ રૂ ૧.૧.૦૦ વસુલ કરવા.
૧૮.	સોલવંશી સર્ટીફિકેટ નાં કમિશન બાબત.	૧. સોલવંશીની રકમના ૦.૬૦ % ૨. મીનીમમ રૂ.૬૦૦/- ૩. મહત્તમ મર્યાદા રૂ.૧૬૦૦૦/- ૪. એજ્યુકેશનના હેતુ માટે -સોલવંશી સર્ટીફિકેટ ની કોઈપણ લિમીટ માટે રૂ.૩,૦૦૦/-
૧૯.	L. C. (Letter of Credit) કમિશન બાબત.	A. સામેની બેન્ક દ્વારા L.C.ઇસ્યુ થાય તે બેન્ક દ્વારા જે કમિશન લેવાય તે કરમટરે ભોગવવાનું રહેશે.૨.૦૦% ચાર્જ. B.L.C આપણી બેન્ક દ્વારા ઇસ્યુ થાય ત્યારે કમિશન ૪.૦૦ % ચાર્જ કરવું.
૨૦.	બેન્ક ગેરંટી અંગેના કમિશન બાબત. A. પરફોરમન્સ બેન્ક ગેરંટી ની રકમ ઉપર B. ફાયનાન્સીયલ બેન્ક ગેરંટીની રકમ ઉપર	૨.૫૦ % ૪.૦૦ %

	C. ૧૦૦% માર્જિન વાળી બેન્ક ગેરન્ટી ની રકમ ઉપર	૨.૦૦%
૨૧.	ડ્રાફ્ટ / ચેક ઈસ્યુ ઉપર કમિશન બાબત A. આપણી બેન્કની શાખાઓ ઉપર ઈસ્યુ થતા ડ્રાફ્ટો તથા બ્રાન્ચો વચ્ચે થતા ફંડ ટ્રાન્સફર માટે ખાતેદારો પાસે B. ખાતેદાર પોતાના ખાતાના ચેક થો ચેક ખરીદે તો C. શેર્સ/ડીબેન્ટર્સ મ્યુચ્યુઅલ ફંડ કે કંપની ડીપોઝીટ માં રોકાણ માટે ઈસ્યુ થતા ચેક/ડ્રાફ્ટ માટે D. શૈક્ષણિક ફી ભરવા માટે ઈસ્યુ થતા ચેક/ડ્રાફ્ટ	No Charge ડ્રાફ્ટ ની રકમના ૦.૨૦ % (મીનીમમ કમિશન રૂ.૩૦.૦૦) ડ્રાફ્ટની રકમના ૦.૪૦ % (મીનીમમ કમિશન રૂ.૬૦.૦૦) No Charge
	E. બેન્કનાં ખાતેદાર હોય તેવી વ્યક્તિ રોકડેથી ચેક ખરીદ રૂ.૫૦,૦૦૦ કે તેથી વધુ રકમનાં ચેક રોકડે થી આવશે નહીં. આપવા તેમજ બેન્કનો ગ્રાહક ન હોય તેને રોકડેથી ચેક આપવા આવશે નહીં.	ડ્રાફ્ટની રકમના ૦.૫૦ % (મીનીમમ કમિશન રૂ.૬૦.૦૦) કરન્ટ ખાતાઓમાં રૂ.૫૦,૦૦૦/- લઘુત્તમ બેલેન્સ સતતપણે રાખે તેને. ઓવરડ્રાફ્ટ ખાતેદાર અલગ કરન્ટ ખાતામાં રૂ.૧૦૦૦૦૦ જમા કરાવે તથા આ રકમ સતત જમા રહે તો એ ઓવર ડ્રાફ્ટ ખાતેદારને ફી ડ્રાફ્ટ / ચેક ની સવલત આપવી.
૨૨.	વહીવટી ધિરાણમાં બેંકમાં ૨ મહિના સુધી પેપર્સ (આરસી બુક વિ.) સબમીટ કરવામાં ના આવે તો પેનલ્ટી	રૂ. ૧૦૦૦ તથા પ્રતિ દિવસ રૂ.૧૦૦/-
૨૩	M.C.B. / D.B.P. માં વટાવેલા ચેકો ઉપર ..	રીઝર્વબેન્કની ગાર્ડલાર્શન મુજબ BC નું કમિશન તથા ૩ દિવસ સુધી વ્યાજનાં સરકયુલર મુજબ વ્યાજ લેવું અને બીલ પરચેઈઝ કર્યાની તારીખ થી સાત દિવસમાં બીલ સ્વીકારાવાની એક્વાઈઝ ન મળે તો આઠમા દિવસ થી એક્વાઈઝ મળ્યા ની તારીખ સુધી વધારાનું નિયમ મુજબનું વ્યાજ + ૨.૦૦% પીનલ વ્યાજ લેવાશે. (વ્યાજ કે પીનલ વ્યાજ ઉપર GST ગણાશે નહીં.)+કુરિયર કે પોસ્ટેજ ચાજીસ.
૨૪	UBP હેઠળ વટાવેલા બીલો ઉપર. .	(૧). મંજૂરીપત્રમાં જણાવેલ વ્યાજ ના દરે ડીસ્કાઉન્ટ કર્યા ની તારીખ થી ડ્યુ તારીખ સુધીનું વ્યાજ બીલ ડીસ્કાઉન્ટ કરતી વખતે લેવાશે.
	નોંધ :- UBP માં વટાવેલ બીલો ઉપર વ્યાજ કે પીનલ વ્યાજ લેવામાં આવે છે તેનાં ઉપર સર્વિસ ટેક્સ વી. લાગુ પડશે નહીં. ફક્ત જે કમિશન ચાર્જ કરો + કુરિયર કે પોસ્ટેજ ચાર્જ લેવાશે. તેના ઉપર GST લાગુ પડશે.	(૨). ડ્યુ તારીખ ઉપરાંત ૨% વધારાનું પીનલ વ્યાજ ચાર્જ થશે. (૩). કમિશન હજારે રૂ.૩.૫૦ ચાર્જ+પોસ્ટેજ કે કુરિયર ચાર્જીસ.
૨૫	એલ.બી.સી. (લોકલ કલેકશન માટે બહારગામ થી આવતા	

	બીલો / રસીદો ઉપર) A. કમિશન B. બીલ મળ્યાની તારીખ થો ૭ દિવસ બાદ દરરોજનાં કરંટડી ચાર્જ C. કુરિયર/રજી. પોસ્ટેજ ચાર્જ	LBC ની રકમના ૦.૫૦% મીનીમમ રૂ. ૫૦/- દૈનિક રૂ. ૫. અનુક્રમ (૨) મુજબ અગાઉની અન્ય સુચનાઓ વધાવતા રહેશે.
૨૬	સેવિંગ્સ ખાતામાં નામ માં વધારો કરવા માટે ઓથોરાઈઝડ સીગ્નેચર માં ફેરફાર કરવું ખાતામાં (દા.ત. ભાગીદારના નામમાં વધવટ થાય / પાવર ઓફ એટોર્ની આપવામાં આવે વિગેરે)	રૂ. ૧૦૦/- રૂ. ૧૫૦/-
૨૭	કરંટ / ઓવરડ્રાફ્ટ ખાતા માં ત્રિમાસિક રટેશનરી ચાર્જીસ (Ledger Folio Charges)	ત્રિમાસિક ધોરણે રૂ. ૧૦૦/-.
૨૮	RTGS / NEFT ચાર્જીસ	રીઝર્વ બેંક ની ગાઈડ લાઈન મુજબ RTGS રૂ. ૨ લાખ થો ૫ લાખ સુધી રૂ. ૨૫/- રૂ. ૫ લાખ થો વધુ રૂ. ૫૦/- NEFT તથા શાખામાંથી થતા IMPS રૂ. ૧૦૦૦૦/- સુધી રૂ. ૨.૫૦ રૂ. ૧૦૦૦૧/- થી રૂ. ૧૦૦૦૦૦/- રૂ. ૫.૦૦ રૂ. ૧૦૦૦૦૧/- થી ૨૦૦૦૦૦/- રૂ. ૧૫.૦૦ રૂ. ૨૦૦૦૦૧/- થી વધુ રૂ. ૨૫.૦૦/- કરંટ ખાતામાં રૂ. ૫૦,૦૦૦/- લઘુતમ બેલેન્સ સતતપણે રાખે તો RTGS / NEFT Free ઓવરડ્રાફ્ટ ખાતા માટે અલગ કરંટ એકાઉન્ટમાં સતતપણે રૂ. ૧,૦૦,૦૦૦/- લઘુતમ બેલેન્સ રાખે તો RTGS/NEFT Free
૨૯	ATM કાર્ડ	પ્રથમ વર્ષે કાર્ડ ફ્રી આપવો. ત્યારબાદ વાર્ષિક ફ્રી રૂ. ૧૫૦/- (૧૬ એપ્રિલ-૨૧) કાર્ડ રીપ્લેસમેન્ટ ફ્રી રૂ. ૧૫૦/- પીન રીપ્લેસમેન્ટ ફ્રી રૂ. ૫૦/-
૩૦	રેટેન્ડીંગ ઈન્સ્ટ્રુકશન	રૂ. ૧૦૦/- (Balance Short તો)
૩૧	Mobile SMS Alerts	રૂ. ૧૦/- quarterly SB A/C (૧૬ એપ્રિલ-૨૧)
૩૨	IMPS સર્વિસ (મોબાઈલએપ) (રજીસ્ટ્રેશન તથા ટ્રાન્ઝેક્શન)	Free
૩૩	પ્રોસેસીંગ ચાર્જ	૦.૩૦% + GST વસુલ લેવો.

	(રૂા.૧.૦૦ લાખ થો વધુની લોન માટે) (ફીક્ડ ડીપોઝીટ, NSC, જાત જામીન ધીરાણો સિવાય) બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન માટેના ધીરાણો (૨૮-૦૨-૨૦૨૩થી)	૧%
૩૪	ઓવરડ્રાફ્ટ ધીરાણો રીન્યુઅલ ચાર્જીસ (સ્ટોક, બુકડેબ્ટ, જોઈન્ટ લીમીટ તથા OAP ધીરાણો માટે)	૦.૧૦% + GST વસુલ લેવો."
	સ્વીચ ઓવર ચાર્જીસ ટર્મલોન (હાઉસીંગ લોન સિવાય)માં આઉટસ્ટેન્ડીંગ રકમના લેમજ CC/OD ખાતાઓમાં સેન્કશન લિમીટ ના (૧૬-૧૨-૨૦૨૧ થી)	૨% + GST
૩૫	દાગીના કસ્ટડી ચાર્જ (તા.૨૬-૯-૨૦૧૮)	દાગીના ધિરાણ ખાતુ બંધ થયાના દિવસે દાગીના પરત ન લઈ જાય તો ૧૫ દિવસ પછી દર મહિને રૂા.૧૦૦/-
૩૬	કેશ કલેક્શન ચાર્જીસ (દૈનિક ધોરણે)	- સેવિંગ્સ / કરન્ટ / કેશ કેડીટ - ઓવરડ્રાફ્ટ ખાતામાં દૈનિક ધોરણે જમા થતી કેશ રકમ ઉપર - દૈનિક રૂા.૧૦/- અને રૂા.૨૦/- ના બંડલ પર પ્રત્યેક બંડલ દીઠ- રૂા.૧૦/- (કોઈપણ ડીનોમેશન ના ૧૦૦ સિક્કા ના બંડલ માટે પણ પ્રત્યેક બંડલ દીઠ રૂા.૧૦/- ચાર્જ) (૧૫-૧૧-૨૦૧૯) - ઉપરોક્ત ચાર્જ રીવર્સ કરવામાં આવશે નહીં.
૩૭	ડુપ્લીકેટ શેર સર્ટીફિકેટ	સર્ટીફિકેટ દીઠ રૂા.૨૦.૦૦ ચાર્જ
૩૮	મેન્ડેટ ચાર્જીસ (વન ટાઈમ)	રૂા.૨૦૦/-+GST (તા.૧-૪-૨૦૨૦)
૩૯	CC/HPOD/BD/OAP/JOINT LIMIT ખાતાઓમાં Quarterly Commitment Charges	સેન્કશન લિમીટ થો ૫૦% ઓછો ઉપાડ થયો હોય તો Unused Portion પર ૦.૫૦% નાં વાર્ષિક દરે Quarterly Commitment Charges લેવામાં આવશે. (૦૧-૦૧-૨૦૨૩)
૪૦	કરન્ટ ખાતા માં કેશ ડિપોઝીટ ચાર્જીસ	છેલ્લા મહિનામાં એવરેજ બેલન્સ ના ૧૦ ગણા સુધી કોઈ ચાર્જીસ લેવાશે નહી, ૧૦ ગણાથી વધુ રકમ પર દર હજારે ૦.૭૦ પૈસા ચાર્જ વસુલવામાં આવશે. (૦૧-૦૧-૨૦૨૪)

